

RAN-2508000605020007
T.Y.B.Com. (Sem.- V) Examination March - 2026
Tax Procedure and Practice (Paper-V) Income Tax
Time: 2 Hours]
[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book (2) આ પ્રશ્નપત્રમાં જમણી બાજુના અંક ગુણ દર્શાવે છે. Numbers to the left in this Question paper indicates total marks of the respective question. (3) જરૂરી ગણતરી જવાબના ભાગરૂપે દર્શાવો. Show necessary calculations as a part of your answer:	Seat No.: Student's Signature
--	--

- પ્ર.1. ટૂંકમાં જવાબ આપો (ગમે તે પાંચ) (10)**
1. શ્રેષ્ઠતમ આકારણી એટલે શું?
 2. સારાંશ (સમરી) આકારણી એટલે શું?
 3. રિફંડ એટલે શું? રિફંડ અંગેનો દાવો કોણ કરી શકે છે?
 4. ભૂલ સુધારણામાં કેવી ભૂલો સુધારી શકાય?
 5. ભૂલ સુધારણા અરજી ક્યારે કરી શકાય?
 6. કલમ 240 હેઠળ અપીલ પર રિફંડ એટલે શું?
 7. અપીલ ક્યા ઓર્ડર સામે થઈ શકે?
- પ્ર.2. (અ) પ્રાચીન સમયમાં રાજ્યની આવકના સ્ત્રોતો સમજાવો. (7)**
- પ્ર.2. (બ) આવક વેરા કાયદા હેઠળ વિવિધ પ્રકારની આકારની જણાવો. સંક્ષેપ્ત આકારણી અને શ્રેષ્ઠતમ આકારણી વિગતવાર સમજાવો. (7)**
- અથવા**
- પ્ર.2. (અ) દંડમાંથી મુક્તિ આપવા માટે કમિશનરની સત્તા સમજાવો. (7)**
- પ્ર.2. (બ) પ્રાચીન ભારતીય કરવેરાના વૈદિક નિયમો અને હેતુઓ સમજાવો. (7)**
- પ્ર.3. (અ) કોણ હાઈકોર્ટમાં અપીલ કરી શકે? હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવા માટેની સમય મર્યાદા જણાવો. (7)**
- પ્ર.3. (બ) દંડની વસુલાત માટેની પ્રક્રિયા સમજાવો. (7)**
- અથવા**
- પ્ર.3. (અ) કલમ 143(1) હેઠળ આવકના રિટર્નમાં કરદાતા દ્વારા જાહેર કરાયેલ આવકમાં આકારણી અધિકારી દ્વારા ક્યા ફેરફારો કરી શકાય છે? (7)**
- પ્ર.3. (બ) એપેલેટ ટ્રિબ્યુનલની કામગીરી સમજાવો. (7)**

- પ્ર.4. ટૂંકનોંધ લખો (ગમે તે ત્રણ) (12)
1. પ્રાચીન ગ્રંથોમાં કરવેરાના સિધ્ધાંતો.
 2. અપીલ પર રિફંડ
 3. ભૂલ સુધારણા અંગેની પ્રક્રિયા.
 4. દંડની માફી
 5. આવક છુપાવા સંબંધી દંડ

ENGLISH VERSION

- Q.1. Answer the following questions (Any five) (10)**
1. What is Best Judgement Assessment?
 2. What is Summary Assessment?
 3. What is Refund? Who can claim refund?
 4. What type of mistakes can be rectified in Rectification of Mistakes?
 5. When can Rectification of Mistake application be filed?
 6. What is refund on appeal as per section 240?
 7. Appeals can be filed against which order?
- Q.2. (A) Explain the sources of income for the state in ancient times? (7)**
- Q.2. (B) State the types of assessments under Income Tax Act. Also explain summary assessment and Best Judgement Assessment in detail. (7)**
- OR**
- Q.2. (A) Explain Powers of the Commissioner to grant immunity from Penalty. (7)**
- Q.2. (B) Explain Vedic rules and Purpose of Ancient Indian Taxation. (7)**
- Q.3. (A) Who can file appeal to High Court? State the time limit for filing appeal to high court? (7)**
- Q.3. (B) Explain the procedure for recovery of Penalty. (7)**
- OR**
- Q.3. (A) What adjustments can be made by assessing officer in Income disclosed by the assessee in the return of income under section 143(1)? (7)**
- Q.3. (B) Explain functioning of Appellate Tribunal (7)**
- Q.4. Write Short notes (Any three) (12)**
1. Principles of Taxation according to ancient texts'
 2. Refund on Appeal
 3. Process of Rectification of Mistakes
 4. Waiver of Penalty
 5. Penalty for hiding of income